


અલ્સરેટીવ કોલાઇટિસ




KAIZEN
HOSPITAL

Institute of Gastroenterology
& Research Centre

Care • Compassion • Cure

» અલ્સરેટીવ કોલાઇટીસ એટલે શું?

અલ્સરેટીવ કોલાઇટીસ એ મોટા આંતરડાની બીમારી છે જેમાં મોટા આંતરડા (Colon) ની અંદરના પડમાં સોજો તથા ચાંદા (Ulcer) પડે છે. આ રોગ સાધારણ રીતે ગુદાથી (Rectum) શરીર થઈને મોટા આંતરડામાં (Colon) પ્રસરે છે. આ રોગ નાના આંતરડા (Small Intestine) માં થતો નથી. આ રોગ ગમે તે ઉંમરે થઈ શકે છે પરંતુ વધારે પ્રમાણમાં એ નાની ઉંમરે (20-30 વર્ષ) જોવા મળે છે.



» અલ્સરેટીવ કોલાઇટીસ ક્યા કારણે થાય છે?

આ રોગનું ચોકક્સ કારણ હજુ શોધાયું નથી, પરંતુ Genes અને વાતાવરણના ફેરફારથી આ રોગનો ઉદ્ભવ થાય છે. આ રોગને Autoimmune રોગ કહેવાય છે, જેમાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિની સામે અમુક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે મોટા આંતરડાના અંદરના પડને નુકશાન કરે છે.

» અલ્સરેટીવ કોલાઇટીસ ના ચિહ્નો ક્યા છે અને તેનું નિદાન કેવી રીતે થઈ શકે?

આ રોગના મુખ્ય ચિહ્નો સતત અથવા વારંવાર ઝાડા થવા, મરડો થવો અને ઝાડામાં લોહી પડવું. રોગના ચિહ્નો શરીરાતમાં સાધારણ હોય અથવા કોઈ દર્દીમાં અતિશાય પ્રમાણમાં દુઃખાવો અને તાવ આવી શકે છે. આ રોગનું ચોકક્સપણે નિદાન કરવા માટે દુરબીનથી તપાસ (Colonoscopy) કરવી પડે છે. સોજ તથા ચાંદામાંથી તપાસ માટે ટુકડો (બાયોપ્સી) લઈને આ રોગનું પાકું નિદાન થઈ શકે છે.

» અલ્સરેટીવ કોલાઇટીસના કોમ્પલીકેશન ક્યા થઈ શકે?

અલ્સરેટીવ કોલાઇટીસ એક અનિશ્ચિત બિમારી છે. કોઈક દર્દીને વર્ષો સુધી રોગ કાબુમાં રહે છે જ્યારે કેટલાક દર્દીને ગંભીર અને જાનને જોખમ થઈ શકે તેવા કોમ્પલીકેશન થઈ શકે છે. ઝાડાનું પ્રમાણ તથા બીડીંગ વધી જવાને (Relapse) કહેવામાં આવે છે અને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. કોઈક દર્દીમાં આંતરડું કુલી જાય છે (Megacolon) અને એમાંથી આંતરડું ફાટી શકે છે (Perforation) આ અતિશાય ગંભીર કેસ ગણવામાં આવે છે. ઘણાને ઝાડામાં અતિશાય રક્તસ્ત્રાવ થાય છે.

લાંબાગાળાનો રોગ અને વધારે પ્રમાણમાં આંતરડાને અસર થતી હોવાથી આ રોગમાંથી કેન્સરનું પરિવર્તન થઈ શકે છે. આ દર્દીઓનું નિદાન જલદી ન થવાથી જોખમ વધી જાય છે. આંતરડા સિવાય શરીરના બીજા અવયવોને અસર થવાથી સાંઘાના દુઃખાવા, મણકાની તકલીફ તેમજ ચામડી, આંખો અને પિતાશયની નળીને અસર થઈ શકે છે.


» અલ્સરેટીવ કોલાઇટિસની સારવાર શું છે?

આ રોગનું નિદાન થવાથી સલ્કાની દવાઓ (5 ASA) ચાલુ કરવામાં આવે છે. ઘણાં દર્દીઓને એનીમાની જરૂર પડે છે. રોગનું પ્રમાણ અને અસર વધારે હોય ત્યારે Steroid ની દવાઓ ચાલુ કરવી પડે છે. આ દવાઓની ગંભીર આડ અસરો હોવાથી થોડાં દિવસોમાં બંધ કરવામાં આવે છે. દવાઓનો મુખ્ય હેતુ રોગને કાબુમાં લાવવાનો હોય છે. દવાની સારવારથી રોગ નાબુદ નથી થઈ શકતો જેથી દવાઓ લાંબાગાળા અથવા જુંદગીભર ચાલુ રાખવી પડે છે. કેટલીકવાર ઈમરજન્સી ઓપરેશનની જરૂર પણ ઉભી થઈ શકે છે.

» અલ્સરેટીવ કોલાઇટિસમાં ઓપરેશનની જરૂર કયારે પડે?

આ રોગમાં લગભગ 80 ટકા દર્દીઓને દવાઓથી રોગ કાબુમાં રાખી શકાય છે, જ્યારે બીજા 20 ટકા દર્દીઓ કે જેમનું રોગનું પ્રમાણ વધારે છે અને દવાઓથી રોગ કાબુમાં લાવી શકતો નથી, ઊંમર નાની હોય, વજન ઓછું થતું જણાય, કમભોરી આવે તેવા સંજોગોમાં ઓપરેશન કરવાની જરૂર ઉભી થાય છે.

રોગ 8 વર્ષથી વધારે હોય અને મોટા આંતરડાને વધારે અસર થતી હોય ત્યારે કેન્સરનું જોખમ દર વર્ષ વધતું જાય છે. આ દર્દીઓએ નિયમીત દર વર્ષ કોલોનોસ્કોપી અને બાયોપ્સી કરાવતા રહેવું જોઈએ. રોગ નાની ઊંમરે ચાલુ થયો હોય ત્યારે પણ કેન્સરનું જોખમ વધે છે.



» ઓપરેશન થઈ શકે? તેના ફાયદા શું છે?

ઓપરેશનમાં મોટું આંતરડું તથા ગુદાનો ભાગ કાઢી નાંખવાથી રોગ શરીરમાંથી નાબુદ થઈ જાય છે. રોગની દવા બંધ થઈ જાય છે, દવાના કોમ્પ્લીકેશન્સ અને આડ અસરોમાંથી મુક્ત થવાય છે, રોગની લાંબાગાળે થતી અસરો જેવી કે બ્લીડિંગ થવું, આંતરડું ફાટવું, શરીર અશક્ત થવું, કેન્સર થવું વગેરેમાંથી બચ્ચી જવાયછે.



» અોપરેશન કેવી રીતે થાય છે?

આ ઓપરેશન (Proctocolectomy) એક મેજર ઓપરેશન છે અને તેમાં સામાન્ય જોખમ પણ રહેતું હોય છે. આ ઓપરેશન પેટ ખોલીને અથવા દૂરબીનની મદદથી થઈ શકે છે. ઓપરેશનમાં મોટું આંતરડું કાઢી નાખ્યા પછી નાના આંતરડામાંથી એક ફૂંક્રિમ પાઉચ (Ileal pouch) બનાવવામાં આવે છે અને એ પાઉચને મળમાર્ગના કુદરતી માર્ગ સાથે જોડવામાં આવે છે. આ જોડવાનું કામ સ્પેશીયલ મશીનો દ્વારા (સ્ટેલ્સર) અથવા ટાંકા દ્વારા થઈ શકે છે. આ ઓપરેશનમાં સાધારણ રીતે પેટ ઉપર ઝડપ જવા માટે એક ટેમ્પરરી નાના આંતરડાનો રસ્તો (Ileostomy) બનાવો પડે છે જે બે મહિના પછી બંધ કરી દેવામાં આવે છે. હવે આ ઓપરેશન દૂરબીન થી (લેપ્રોસ્કોપી પદ્ધતીથી) થઈ શકે છે જેથી પેટ ઉપર ઘાવ નાનો આવે છે, દુઃખાવો ઓછો થાય છે અને રીકવરી ઝડપથી થાય છે.

આ ઓપરેશન એ લોકો માટે નથી કે જેમના મળમાર્ગના સ્નાયુ ઘણાં કુમજોર હોય, પરંતુ ઉંમર ઘણી મોટી હોય, ગુદાનું કેન્સર હોય અને Crohns disease નામનો રોગ હોય. આ દર્દીઓમાં ગુદાનો રસ્તો કાઢીને કાયમનો રસ્તો પેટ ઉપર બનાવવો પડે છે (End Ileostomy).

» ઓપરેશનમાં જોખમો કયા છે?

આ ઓપેશનમાં ૧ ટકાથી પણ ઓછું જોખમ છે, પરંતુ નાની-મોટી તકલીફો થવાની શક્યતા ૩૦ થી ૩૫ ટકા જેટલી હોય છે. આ દર્દીઓમાં ઈન્જેક્શન થવાની શક્યતા વધારે હોય છે. કોઇકવાર આંતરડું ચોંટી જવાથી આંતરડાની રૂકાવટ થઈ શકે છે. કોઇક દર્દીઓને પેશાબની અથવા વીર્યની તકલીફ થઈ શકે છે.

» લાંબાગાળે આ ઓપરેશન પછી જુંદગી કેવી હોય છે?

ઓપરેશન પછી કુદરતી રસ્તો અને પાઉચની કામગીરી ચાલુ થવાથી શરૂઆતમાં દર્દીને ૬-૮ વખત ઝડપ થાય છે જે દીરેદીરે ઓછું થઈને ૪-૬ વખત થાય છે. ઝડપનો કંટ્રોલ સારો રહે છે. લગભગ ૮૦ ટકા દર્દીઓ લાંબાગાળે ઓપરેશનથી અતિશય ખુશ હોય છે અને બીજાને આ ઓપરેશન કરાવવા માટે પ્રેરણ આપે છે. તેઓને એક નવી અને નોર્મલ જુંદગી જીવવા મળે છે. કોઇક દર્દીઓને કયારેક પાઉચમાં સોજો થવાથી ઝડપ વધી જાય છે જે દવાથી કાબુમાં લાવી શકાય છે.

દર્દીઓને રોગ નાખું થઈ જવાથી બ્લીડિંગ તથા અન્ય તકલીફોમાંથી મુક્ત થવાય છે તથા રોગની દવાઓ બંધ થઈ જાય છે. રોગ નાખું થવાથી માનસિક સ્તરે પણ દર્દીઓ ઘણી રાહત અનુભવે છે.

KAIZEN HOSPITAL

Institute of Gastroenterology

& Research Centre

Care • Compassion • Cure